



તમારું શહેર. તમારો મત.

ઓક્ટોબર 24

toronto.ca/elections

સપ્ટેમ્બર 1ના રોજ MyVote વાપરવાનું શરૂ કરો.

વેબ એપ્લિકેશન MyVoteમાં તમારે ટોરન્ટો મ્યુનિસિપલ ચૂંટણી માટેની શરૂઆત કરવા માટેનું બધું જ ઉપલબ્ધ છે.

વધુ જાણો: toronto.ca/elections/MyVote



મતદાનના વિકલ્પો

રૂબરૂમાં

તમે મતદાન માટેના ઉપલબ્ધ કોઈપણ દિવસોએ રૂબરૂમાં મતદાન કરી શકો છો. આગોતરા મતદાન દરમિયાન અથવા ચૂંટણીના દિવસે, સોમવાર, ઓક્ટોબર 24 ના રોજ વહેલા મતદાન કરો.

ટપાલ દ્વારા

પગલું 1: ટપાલ દ્વારા મતદાન માટે અરજી કરો

- 1 સપ્ટેમ્બરથી, toronto.ca/VoteByMail ની મુલાકાત લઈ શકો છો.
- અરજી કરવાની છેલ્લી તારીખ શુક્રવાર, સપ્ટેમ્બર 23 સાંજે 4:30 વાગ્યા સુધીની છે.

પગલું 2: તમારું પેકેજ પૂર્ણ કરો

એકવાર મંજૂર થયા પછી, તમને પૂર્ણ કરવા માટે મેઇલ-ઇન વોટિંગ પેકેજ મોકલવામાં આવશે.

- ઘોષણા ફોર્મ પર **સહી કરો**
- મતપત્રને **ચિહ્નિત કરો**
- પીળા જવાબી પરબિડીયામાં સીલબંધ ગુપ્ત પરબિડીયું **દાખલ કરો**

પગલું 3: તમારું પેકેજ ટપાલ કરો

- તમારું પૂર્ણ થયેલું મેઇલ-ઇન વોટિંગ પેકેજ કે જે કેનેડા પોસ્ટ દ્વારા પ્રી-પેઇડ પોસ્ટેજ સાથે આવે છે તે પરત કરો અથવા 7 ઓક્ટોબર અને 21 ઓક્ટોબરની વચ્ચે બપોર (12 વાગ્યા) સુધીમાં પીળા ડ્રોપબોક્સમાંથી કોઈ એક પર પહોંચાડો.
- દરેક વોર્ડમાં એક પીળું ડ્રોપબોક્સ હશે. એવાં સ્થાનોની યાદી અહીં છે: toronto.ca/VoteByMail
- પૂર્ણ થયેલાં મેઇલ-ઇન વોટિંગ પેકેજ શુક્રવાર, ઓક્ટોબર 21 ના રોજ બપોર (12 વાગ્યા) સુધીમાં અચૂક પ્રાપ્ત થવાં જ જોઈએ.

પ્રશ્નો અથવા સુલભતાની સવલતો માટે

- ઈમેઇલ: elections@toronto.ca અથવા 311 પર કૉલ કરો
- અહીં વધુ જાણો: toronto.ca/VoteByMail

પ્રોક્સી દ્વારા

જો તમે ઉપલબ્ધ મતદાનના દિવસોમાં રૂબરૂમાં મત આપી શકતા ન હોવ, તો તમે મતદાન-પ્રોક્સીની નિમણૂક કરી શકો છો. પ્રોક્સી એવી વ્યક્તિ છે જેના પર તમે તમારા વતી મત આપવા માટે વિશ્વાસ કરતા હો અને તે ટોરન્ટોની મ્યુનિસિપલ ચૂંટણીમાં લાયક મતદાર હોય. તમારા અને તમારા પ્રોક્સી દ્વારા સહી કરેલું 'વોટિંગ પ્રોક્સી એપોઇન્ટમેન્ટ ફોર્મ' ભરો અને તેને 24 ઓક્ટોબર સાંજે 4:30 વાગતા પહેલાં સિટી ક્લાર્ક દ્વારા પ્રમાણિત કરાવો.

1 સપ્ટેમ્બરથી, પ્રોક્સી ફોર્મ મેળવવા માટે ટોરન્ટો ઇલેક્શન્સનો સંપર્ક કરો અને VoterRegistration@toronto.ca પર ઇમેઇલ કરીને અથવા 311 પર કોલ કરીને તેને પ્રમાણિત કરવા માટે એપોઇન્ટમેન્ટ લો.

અહીં વધુ જાણો: toronto.ca/VoterAccommodations

મત કોણ આપી શકે

ટોરન્ટોની મ્યુનિસિપલ ચૂંટણીમાં મત આપવા માટે, તમારે માટે આ હોવું અચૂક આવશ્યક છે:

- કેનેડિયન નાગરિક; અને
- ઓછામાં ઓછું 18 વર્ષના; અને
- ટોરન્ટો શહેરમાં નિવાસી; અથવા
- ટોરન્ટોના બિન-નિવાસી, પરંતુ તમે અથવા તમારા જીવનસાથી શહેરમાં મિલકત ધરાવતા હોવ અથવા ભાડે આપતા હો; અને
- કોઈપણ કાયદા હેઠળ મતદાન કરવા માટે પ્રતિબંધિત ન હોવ.

તમે શહેરની અંદર કેટલી મિલકતો ધરાવો છો અથવા ભાડે આપો છો તેને ધ્યાનમાં લીધા વિના તમે માત્ર એક જ વાર મત આપી શકો છો. તમે જ્યાં રહો છો તે વોર્ડમાં જ તમારે મતદાન કરવું પડશે.

મતદાર યાદીમાં પ્રવેશ મેળવો

તમારી માહિતી સાચી છે કે કેમ તે તમારે ચકાસી લેવું મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જો તમે છેલ્લી ચૂંટણી પછી તમારું રહેઠાણ બદલ્યું હોય અથવા નામ બદલ્યું હોય તો. જો તમે મતદાર યાદીમાં હોવ તો તમને મતદાર માહિતી કાર્ડ ટપાલમાં પ્રાપ્ત થશે. આનાથી મતદાનના સ્થળે તમારે વિતાવવાનો સમય ઝડપથી પતશે.

1 સપ્ટેમ્બરથી, મતદાર યાદીમાં તમારી માહિતી આ કરીને ચકાસો, ઉમેરો અથવા અદ્યતિત કરો:

- 23 સપ્ટેમ્બર સુધી MyVote વેબ એપ્લિકેશનનો ઉપયોગ કરીને

- 14 ઓક્ટોબર સુધી VoterRegistration@toronto.ca પર ઇમેઇલ કરીને અથવા 311 પર ફોન કરીને
- આગોતરા મતદાન દરમિયાન (7 થી 14 ઓક્ટોબર) અથવા ચૂંટણીના દિવસે (24 ઓક્ટોબર) તમારા મતદાન મથક પર જઇને

ચૂંટણીના અંતિમ દિવસે મતદાર યાદીમાં તમારું નામ દેખાય તે માટે, તમામ અદ્યતન માહિતી 14 ઓક્ટોબર સુધીમાં અચૂક પૂર્ણ કરવી આવશ્યક છે. આ તારીખ પછી તમે 24 ઓક્ટોબરે મતદાન કરવા જાવ ત્યારે તમે પોતે પોતાને મતદાન મથક પર ઉમેરી શકો છો.

અહીં વધુ જાણો: toronto.ca/elections/Voters

મતદાનના દિવસો

ચૂંટણીનો દિવસ

સોમવાર, ઓક્ટોબર 24, 2022 સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી

આગોતરું મતદાન

શુક્રવાર, ઓક્ટોબર 7 અને શુક્રવાર, ઓક્ટોબર, 14 ની વચ્ચે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી વહેલું મતદાન કરો.

તમારા મતદાર માહિતી કાર્ડ પર તમારા આગોતરા મતદાનનાં સ્થળો દેખાતાં હશે અથવા MyVote વેબ એપ્લિકેશન, toronto.ca/elections/MyVote નો ઉપયોગ કરીને તેમને શોધી શકશો.

વિદ્યાર્થીઓ માટે માહિતી

જો તમે વિદ્યાર્થી હોવ અને જ્યારે તમે શાળામાં હાજરી ન આપતા હો ત્યારે તમે જ્યાં રહેતા હો તે સ્થળને તમારા "ઘર" તરીકે ધ્યાનમાં લો, જેનો અર્થ એ છે કે તમે ત્યાં પાછા ફરવાનું આયોજન કરી રહ્યા છો, તો પછી તમે તમારી "ઘર" નગરપાલિકા અને જ્યાં તમે શાળામાં ભણતા હો ત્યારે રહેતા હોવ એ બંને નગરપાલિકામાં મત આપવા માટે પાત્ર છો..

અહીં વધુ જાણો: toronto.ca/elections/Voters

MyVote

MyVote વેબ એપ્લિકેશનમાં તમારે ટોરન્ટો મ્યુનિસિપલ ચૂંટણી માટેની શરૂઆત કરવા માટેનું બધું જ છે.

તમારું ટોરન્ટોનું સરનામું આ કરવા માટે દાખલ કરો:

- તમે મતદાર યાદીમાં છો કે કેમ તે શોધવા
- તમારી મતદાર યાદીની માહિતી ઉમેરવા, બદલવા અથવા અધતન કરવા (23 સપ્ટેમ્બર સુધી)
- તમારા વોર્ડમાં ઉમેદવારી કરી રહેલા ઉમેદવારોની ખાત્રી કરવા
- ક્યાં અને ક્યારે મત આપવો તે શોધવા
- તમારું મતદાર માહિતી કાર્ડ જોવા, ડાઉનલોડ કરવા અથવા પ્રિન્ટ કરવા
- તમારો વોર્ડ અને નક્શો શોધવા
- તમારા મતદાન મથક વિશેની સુલભતા માહિતી મેળવવા
- તમારા મતપત્રનો નમૂનો જોવા

નોંધ: તમે રૂબરૂ મતદાન કરવા જાવ તે પહેલાં MyVote ચકાસવાનું ચાલુ રાખો, કારણ કે મતદાન મથક બદલાઈ શકે છે.

વધુ જાણો: toronto.ca/elections/MyVote

જ્યારે તમે મત આપવા જાવ ત્યારે, ભલે તમે મતદાર યાદીમાં હોવ તો પણ, તમારે ID અચૂક સાથે લાવવાનું રહેશે.

સુલભતા સવલતો

જો તમને મતદાનમાં અવરોધનો સામનો કરવો પડે, તો elections@toronto.ca પર ઈમેઈલ કરીને અથવા 311 પર કોલ કરીને ટોરન્ટો ઇલેક્શન્સનો સંપર્ક કરો.

મતદાન મથકો

તમે જ્યાં મત આપો છો તે તમામ સ્થળો પહોંચવાની રીતે સુલભ હશે. દરેક સ્થાનની, દાખલા તરીકે રેમ્પ, ઓટોમેટિક ડોર ઓપનર અથવા મતદાર સહાયતા ટર્મિનલ્સ, વિશેની માહિતી અહીં ઉપલબ્ધ છે:

toronto.ca/elections/Voters.

સુલભતા મતદાન સાધન

મતદાર સહાયતા ટર્મિનલ એ મતપત્ર પર નિશાની કરવાનું સાધન છે જે શારીરિક રીતે અસમર્થ મતદારોને તેમના મતપત્રને ખાનગી રીતે અને પોતાની જાતે ચિહ્નિત કરવા દે છે. તેની વિશેષતાઓમાં ટચ સ્ક્રીન, ઓડિયો ફંક્શન, બ્રેઇલ કી પેડ, સિપ/પફ ટ્યુબ ડિવાઇસ, રોકર પેડલ/ફૂટ સ્વીચ અને ઝૂમ ફીચર્સનો સમાવેશ થાય છે જેથી ફોન્ટ સાઈઝ અને કલર કોન્ટ્રાસ્ટ એડજસ્ટ થાય.

મતદાર સહાયતા ટર્મિનલ તમામ આગોતરા મતદાન મથકો પર ઉપલબ્ધ હશે - વોર્ડ દીઠ બે. જો તમને ચૂંટણીના દિવસે મતદાર સહાયક ટર્મિનલનો ઉપયોગ કરવાની જરૂર હોય અને તે તમારા નિર્ધારિત મતદાન મથક પર સ્થિત ન હોય, તો તમે 311 પર કોલ કરીને તમારા મતપત્રને ટ્રાન્સફર કરવાની વિનંતી કરી શકો છો.

અન્ય સેવાઓ

- મતદાન કેવી રીતે કરવું તેની સૂચનાઓ તમામ મતદાન મથકો પર બ્રેઇલ અને 26 ભાષાઓમાં ઉપલબ્ધ હશે.
- ઓછી દ્રષ્ટિ ધરાવતા મતદારોને મદદ કરવા માટે તમામ મતદાન સ્થળો પર મેગ્નિફિકેશન શીટ્સ ઉપલબ્ધ હશે.
- જો તમે મતદાન મથકની અંદર જવા માટે શારીરિક રીતે અસમર્થ હોવ, તો તમે મતદાન મથકની અંદર અન્ય વિસ્તારમાં મદદ કરવા વિનંતી કરી શકો છો. ઉદાહરણ તરીકે પાર્કિંગની જગ્યા અથવા કર્બસાઇડ. વધુ માહિતી માટે 311 પર કોલ કરો.
- 416-338-OTTY (0889) પર TTY લાઇન પર કોલ કરીને બહેરા અથવા સાંભળવાની ઓછી ક્ષમતા ધરાવતા લોકો માટે ચૂંટણીની માહિતી ઉપલબ્ધ છે.
- જો તમે તમારી જાતે તમારા મતપત્રને ચિહ્નિત કરી શકતા ન હોવ તો તમારી મદદ માટે તમે એક મિત્રને સાથે લાવી શકો છો અથવા મદદ માટે તમે ચૂંટણી અધિકારીને કહી શકો છો.
- તમામ મતદાન મથકો સહાયક વ્યક્તિઓ અને સર્વિસ એનીમલ્સના ઉપયોગને આવકારે છે.
- એવા સંજોગોમાં પણ મતપત્ર ટ્રાન્સફરની વિનંતી કરી શકાય છે જ્યાં મતદારને પોતાના નિર્ધારિત મતદાન મથક પર અવરોધનો સામનો કરવો પડી શકતો હોય.

અહીં વધુ જાણો: toronto.ca/VoterAccommodations

સ્વીકાર્ય ઓળખ

જ્યારે તમે મતદાન કરવા જાઓ ત્યારે ઓળખ (ID) જરૂરી છે. તમારું નામ અને ટોરન્ટોના લાયકાત ધરાવતા સરનામું દર્શાવતા ID નો એક ભાગ લાવવાનું યાદ રાખો. તમારા મતદાર માહિતી કાર્ડનો ઉપયોગ IDના ભાગ તરીકે કરી શકાતો નથી.

સ્વીકાર્ય IDનાં ઉદાહરણો:

- ઓન્ટેરિયોએ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા મોટર વાહન પરમિટ (વાહનનો ભાગ), ફોટો કાર્ડ જારી કર્યું હોય.
- રદ કરેલ વ્યક્તિગત ચેક, ક્રેડિટ કાર્ડ અથવા બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ.
- હાઇડ્રો, ટેલિફોન અથવા કેબલ ટીવી, પાણી, ગેસ માટે યુટિલિટી બિલ અથવા જાહેર ઉપયોગિતા કમિશન તરફથી બિલ.
- રોજગારદાતા દ્વારા જારી કરાયેલ ચેક સ્ટબ, T4 સ્ટેટમેન્ટ અથવા પગારની રસીદ.
- ઓન્ટેરિયો વર્ક્સ અથવા ઓન્ટેરિયો ડિસેબિલિટી સપોર્ટ પ્રોગ્રામ માટે સીધી ડિપોઝિટનું સ્ટેટમેન્ટ.
- પ્રોપર્ટી ટેક્સ એસેસમેન્ટ, ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ નોટિસ, ચાઇલ્ડ ટેક્સ બેનિફિટ સ્ટેટમેન્ટ.
- મોર્ટગેજ સ્ટેટમેન્ટ, લીઝ અથવા ભાડા કરાર.
- પોસ્ટ-સેકન્ડરી સ્કૂલમાંથી ટ્રાન્સક્રિપ્ટ અથવા રિપોર્ટ કાર્ડ.
- કેમ્પસ રહેઠાણ દર્શાવતો દસ્તાવેજ, જે ઓફિસ દ્વારા અથવા પોસ્ટ-સેકન્ડરી સંસ્થામાં વિદ્યાર્થીના નિવાસ માટે જવાબદાર અધિકારીઓ દ્વારા જારી કરવામાં આવે છે.
- કેનેડાની સરકાર, ઓન્ટેરિયો અથવા ઓન્ટેરિયોમાં મ્યુનિસિપાલિટી તરફથી કોઈપણ અન્ય દસ્તાવેજ અથવા ઓન્ટેરિયોની કોર્ટ દ્વારા જારી કરાયેલ અથવા પ્રમાણિત કરાયેલ દસ્તાવેજ.
- ઇન્ડિયન એક્ટ (કેનેડા) હેઠળ સ્થાપિત ઓન્ટેરિયોમાં બેન્ડ કાઉન્સિલના કોઈપણ દસ્તાવેજ.
- વીમા પોલિસી અથવા વીમાનું નિવેદન.
- નાણાંકીય સંસ્થા સાથેનો લોન કરાર અથવા અન્ય નાણાંકીય કરાર.
- T4E ચૂકવવામાં આવેલ રોજગાર વીમા લાભોનું નિવેદન.
- વૃદ્ધાવસ્થા સુરક્ષા T4A (OAS), કેનેડા પેન્શન પ્લાન લાભો T4A (P), કેનેડા પેન્શન પ્લાન યોગદાનનું નિવેદન.
- કાર્યસ્થળની સલામતી અને વીમા બોર્ડ WSIBના લાભોનું નિવેદન T5007.
- CNIB કાર્ડ અથવા અન્ય રજિસ્ટર્ડ ચેરિટેબલ સંસ્થાનું કાર્ડ જે શારીરિક રીતે અસમર્થ વ્યક્તિઓને સેવાઓ પૂરી પાડતી હોય.

- લોગ-ટર્મ કેર હોમ્સ એક્ટ, 2007 હેઠળ ઘર માટે એડમિનિસ્ટ્રેટર દ્વારા જારી કરાયેલ લોગ-ટર્મ કેર હોમમાં રહેઠાણ દર્શાવતો દસ્તાવેજ.
- હોસ્પિટલ કાર્ડ અથવા રેકોર્ડ.

જો તમારી પાસે સ્વીકાર્ય ID ન હોય અને તમે મતદાર યાદીમાં ન હોવ, તો મતપત્ર મેળવવા માટે તમને તમારા ID સાથે પાછા ફરવાનું કહેવામાં આવશે.

અગત્યની તારીખો

1 સપ્ટેમ્બર

- ટપાલ દ્વારા મતદાન માટે અરજી કરવાનો પ્રથમ દિવસ
- મતદાર યાદીમાં તમારી માહિતી ઉમેરવા, બદલવા અથવા અધતન કરવાનો પ્રથમ દિવસ

23 સપ્ટેમ્બર

- ટપાલ દ્વારા મતદાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ સાંજના 4:30 વાગ્યા સુધીમાં.

26 સપ્ટેમ્બરનું અઠવાડિયું

- મતદાર માહિતી કાર્ડ ટપાલમાં હશે

7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર

- આગોતરું મતદાન

21 ઓક્ટોબર

- ટપાલ દ્વારા મતદાનનું પેકેજ 21 ઓક્ટોબર સુધીમાં, બપોરે (12 વાગ્યા) સુધીમાં ટોરન્ટો ઇલેક્શન્સને અચૂક પ્રાપ્ત થઈ જાય તે આવશ્યક છે.

સોમવાર, ઓક્ટોબર 24: ચૂંટણીનો દિવસ



@cityoftoronto



City of Toronto



@cityofto

Web: toronto.ca/elections Email: elections@toronto.ca